

B.A. Semester - 2 (CBCS) Examination**March/April - 2023 (OLD COURSE)****ECONOMICS : P3 PRINCIPLES OF ECO-2 (ELECTIVE-1)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચનો ખ્યાલ ઉદાહરણ સાથે સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ સરેરાશ અને સિમાંત ખર્ચનો અર્થ આપી તેની વચ્ચેના સંબંધો આકૃતિ સાથે સમજાવો.
- પ્રશ્ન-૨ વહેંચણીનો સિમાંત ઉત્પાદકતાનો સિધ્ધાંત સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ ઘટતા મળતરનો નિયમ આકૃતિ સાથે સમજાવો.
- પ્રશ્ન-૩ નફોએ નવપ્રવર્તનનું પરીણામ છે. - સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ ભાડાનો આધુનિક સિધ્ધાંત સમજાવો.
- પ્રશ્ન-૪ નફા અંગેનો જોખમ અને અનિશ્ચિતતાનો સિધ્ધાંત સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ નફા અંગેનો શુમ્પિટરનો સિધ્ધાંત સમજાવો.
- પ્રશ્ન-૫ ટ્રેકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
- 1) ભાડા જેવી આવક
 - 2) વહેંચણીના સિમાંત ઉત્પાદકતાના સિધ્ધાંતની ઉપયોગીતા
 - 3) શુદ્ધ નફો અને કાયો નફો
 - 4) વાસ્તવિક ખર્ચ અને નાણાંકીય ખર્ચ

ENGLISH VERSION

- Que-1 Explain concept of Fix cost, variable cost and total cost with example. (14)
OR
- Que-1 Give the meaning of average and marginal cost. Explain the interrelationship between average and marginal cost with diagram.
- Que-2 Explain the marginal productivity theory of distribution. (14)
OR
- Que-2 Explain the law of diminishing return with diagram.
- Que-3 Explain- Profit is result of Innovation. (14)
OR
- Que-3 Explain the modern theory of rent.
- Que-4 Explain the risk and uncertainty theory of profit. (14)
OR
- Que-4 Explain the theory of rent given by Prof. Schumpeter.
- Que-5 Write short notes. (Any Two) (14)
- 1) Quasi Rent
 - 2) Importance of marginal productivity theory
 - 3) Net Profit & Gross Profit
 - 4) Real cost and monetary cost
